

અક્ષમ યુથ

ડિસેમ્બર ૨૦૧૮ ગુજરાતી

દાદા ભગવાન પરિવાર

₹20

વિનય





સંપાદકીય

મિત્રો, જ્યારે જ્યારે પણ આપણે કંઈક મેળવવા, સફળતાના શિખરો સર કરવા કે જીવનના નાના મોટા પ્રસંગોમાં આનંદ મેળવવા મથીએ છીએ ત્યારે સફળ અને મહાન પુરુષોએ એમના જીવનમાં એવું તો શું કર્યું હતું એ જાળવાના પ્રયત્નો કરીએ છીએ. એમના જીવન ચિઠ્પો વાંચતા આપણાને તેઓની સફળતાની ચાવીઓ જાળવા મળે છે. જેમાંની એક ચાવી છે - એમણે કેળવેલા ગુણો. આ ગુણોમાંનો એક ગુણ છે - “વિનય” જેની આપણે આ અંકમાં વાત કરીશું. વિનય એટલે શું? આપણા જીવનમાં તેની શું અસરો થાય? અને મહાનપુરુષોએ આ ગુણ કેવી રીતે કેળવ્યો એ જાણીશું. દાદાશ્રીની દ્રષ્ટિએ વિનય શું છે? અવિનયથી વિનય તરફ કેવી રીતે જવાય અને આપણા સપના પૂરા કરી આનંદપૂર્વક જીવવા માટે વિનયી કેવી રીતે બનાય તે જાણીએ, માણીએ અને જીવનના દરેક તબક્કે દાદાશ્રીની કેડી પર ચાલવાનો પ્રયાસ કરીએ.

- ડિમ્પલ મહેતા

અનુક્રમાંદ્રા

વર્ષ: ૬, અંક : ૮

સંપાદક અંક : ૬૮

ડિરેક્ટર ૨૦૧૮

સંપર્ક સૂત્ર :

જાનીની છાચામાં,

ભિમંદિર સંકુલ, સીમંઘાર સીઠી,

અમદાવાદ-કલોલ હાઇવે,

મુ.પો. - અડાલજ

જી.ગાંધીનગર-૩૮૨૪૪૧, ગુજરાત.

ફોન : (૦૭૯) ૩૮૮૩૦૯૦૦

email: akramyouth@dadabhagwan.org

website: youth.dadabhagwan.org

store.dadabhagwan.org/akram-youth

તંત્રી - ડિસ્પલ મહેતા

Printer & Published by

Dimple Mehta on behalf of

Mahavideh Foundation

Simandhar City, Adalaj -

382421. Taluka & Dist - Gandhinagar

Owned by

Mahavideh Foundation

Simandhar City, Adalaj -

382421. Taluka & Dist - Gandhinagar

Published at

Mahavideh Foundation

Simandhar City, Adalaj -

382421. Taluka & Dist - Gandhinagar

Printed at : Amba Offset

B-99, GIDC, Sector-25,

Gandhinagar – 382025.

Gujarat.

Total 24 Pages with Cover page

Subscription

Yearly Subscription

India : 200 Rupees

USA: 15 Dollars

UK: 12 Pounds

5 Years Subscription

India : 800 Rupees

USA: 60 Dollars

UK: 50 Pounds

In India, D.D. / M.O. should be drawn
in favour of "Mahavideh Foundation"
payable at Ahmedabad.

© 2018, Dada Bhagwan Foundation.
All Rights Reserved

04 પોલ

05 વિનય એટલે શું ?

06 વિનય અલગ અલગ ધર્મીમાં

08 દાદાશ્રીના પુસ્તકની જલક

10 ઉંઘી તપેલી

12 વિનયના ફાયદા- અવિનયના નુકસાન

14 Q & A

15 અવિનય ક્યાં ક્યાં થાય છે?

16 અવિનયથી વિનય તરફ

18 જ્ઞાની પુરુષનો પરમ વિનય

21 વિનય કે અવિનય?

22 મગજમારી

પોલ ચાલો, જાણીએ ‘વિનય એટલે શું?’ વડીલો, ચુવાવર્ગ અને જ્ઞાનીની દ્રષ્ટિઅથી.

વડીલોની દ્રષ્ટિઅથી વિનય

નમૃતાથી વાત કરવી.
સરળ બનવું.
વડીલોની આજ્ઞામાં રહેવું.
આધીનતા એ જ વિનય.
બદા સાથે પ્રેમથી વ્યવહાર કરવો.
સામી વ્યક્તિત્વોના કહ્યા પ્રમાણે કરવું એટલે વિનય .
બીજાને માન આપવું.
આદર સંઠાર કરવો.

ચુથની દ્રષ્ટિઅથી વિનય

કોઈ જીવને કિંચિત્માશ હુઃખ ન આપવું.
વડીલોની સેવા કરવી.
કોઈ આપણને જે કામ આપે તે સાંભળવું અને કરવું.
કોઈની ઉપરવટ ન જવું.
તરછોડ ન કરવી.
ન ગમતી વ્યક્તિત્વોના પોજિટિવ જોવા.
આપણને આપેલું કામ દિલથી કરવું.
કોઈને નાના ન ગણવા.
અહુંકાર રહિત વ્યવહાર.
નાનામાં નાની વ્યક્તિનો વિવેક રાખવો અને બદાને માન આપવું.

જ્ઞાનીની દ્રષ્ટિઅથી વિનય એટલે શું?

પ્રશ્નકર્તા: વિનય એટલે શું ? શું રીતભાત સારી હોય તેને વિનય કહેવાય ?

દાદાશ્રી : હા , બરોબર. એ રીતભાત તો બધી નાની સામાન્ય વ્યવહાર ભાષામાં વપરાય છે. વિનય ધર્મને માટે હોય. વિનય આત્મા માટે, અદ્યાત્મ માટે હોય છે અને આ ભૌતિક માટે વિવેક. વ્યવહારમાં વિનય ન હોય. આપણા લોકો વિવેકની જગ્યાએ વિનય બોલે છે.

વિનય એટલે શું ?

વિનય એટલે પોતાના અહંકારને ડાઉન રાખે, કોઈપણ વ્યક્તિ, નાની કે મોટી તેની સામે હું કંઇક છું, આના કરતાં વધારે મને આવડે છે. એવા કોઈ ભાવ જ ન હોય.

જેને હંમેશાં બીજુ વ્યક્તિના પોજિટિવ પોર્ટન્ટ્સ, તેના ગુણો દેખાય છે અને પોતાનાથી નીચાપણું નથી વત્તાંતું તે વિનય છે.

પોતાનાથી ઓછું ભણેલા આવે તો તેના બીજા સદ્ગુણો શોધી કાઢવાની દ્રષ્ટિ, નાની ઊંમરનું બાળક મળે તો તેની લઘૃતમતા અને નિખાલસતા જોઈને પોતે તેનાથી પણ લઘૃતમ બની જાય. પોતાનો અહંકાર એટલો લઘૃતમ બનાવે કે બાળકથી લઈને વડીલો દરેકને પોતાના જ લાગે. એ વિનય.

વિનય એ એવો ભાવ છે જે કદાચ વર્તનમાં ન દેખાય. પરંતુ, સમજણમાં અને દ્રષ્ટિમાં દેખાય. એવી લઘૃતમ દશા, જે ગમે તેવી નેગેટિવ વ્યક્તિમાંથી પણ પોજિટિવ શોધી કાઢે.

“વિનય એટલે વિશેષ નથ્ય”.

આમાદ્ય માણસો કરતાં કંઈક અલગ

જ તેની દ્રષ્ટિ હોય. વિશેષ રૂપે જગતને જોઈ શકે અને સમજી શકે. ગમે તેટલું ઊંચું પદ પ્રાપ્ત કરે છતાં દરેક માટે સમાન દ્રષ્ટિ અને પોતે તેમાં સમાઈ જાય.



વિનય એટલે
બીજું કર્શું નહિ,
માત્ર સાચી સમજણ

ધિનાચ

અલગ અલગ ધર્મોમાં

અલગ-અલગ ધર્મોમાં વિનયને કેટલું મહત્વ આપવામાં આવ્યું છે એ આ લેખમાં આપણે જોઈશું.



ભ ગવાન બુદ્ધના સમયની વાત છે. તે ચાતુર્મસ કરતા હતા અને રોજ ઘરે ઘરે ભિક્ષા માંગવા જતા હતા. એક બ્રાહ્મણને તેમના પ્રત્યે બહુ ચીડ હતી. તેની કર્મકાંડની આવક ઘટતી જતી હતી. તેણે તેની પત્નીને કહ્યું હતું કે બુદ્ધ ઘરે આવે તો તેને ભિક્ષામાં કશું જ આપવું નહીં. બીજા દિવસે બુદ્ધ બ્રાહ્મણના ઘરે આવી ઊભા રહ્યા. બ્રાહ્મણની પત્નીએ એમને વંદન કર્યા અને વિવેકપૂર્વક કહ્યું, ‘આપને આપવા માટે આજે મારી પાસે ઘરમાં કશું જ નથી.’ બુદ્ધ શાંતિપૂર્વક ચાચ્યા ગયા. આવું ત્રણ દિવસ ચાચ્યું. ચોથે દિવસે પણ બુદ્ધ એ બ્રાહ્મણના ઘરે ભિક્ષા લેવા આવ્યા ત્યારે બ્રાહ્મણ પોતે કોઈમાં રાતાપીળ થતા ઘરની બછાર આવ્યા અને બુદ્ધને કહ્યું, ‘ત્રણ ત્રણ દિવસથી મારી પત્ની તમને ના પાડે છે તો પણ તમે મારા ઘરે શા માટે આવો છો? તમને ‘ના’ નો અર્થ સમજાતો નથી? તમને શરમ નથી?’ ભગવાન બુદ્ધને વડીલોને નમર્સ્કાર, નાનાઓને નમર્સ્કાર, ચુવાનોને નમર્સ્કાર, વૃદ્ધોને નમર્સ્કાર, અમે સામર્થ્યવાન અને દેવપૂજક બનીએ. હે દેવગણ, હું મારાથી મોટાનું હંમેશાં સંભાન કુરું’ (ઋગવેદ ૧/૨૭/૧૩)



હિંદુ ધર્મના પ્રથમ વેદ ઋગવેદમાં કહ્યું છે, ‘પ્રત્યેક પદ સાથે જોડાયેલો છે. એ વિનયનું કેટલું મોટું મહિમાગાન છે !

દરેક ધર્મોમાં નમન, નમર્સ્કાર કે વંદન કરવાની વાત કરીને વિનયની જ મહત્વતા દર્શાવવામાં આવી છે, એ પછી હિંદુ ધર્મ હોય, જૈન ધર્મ હોય કે બૌધ્ધ ધર્મ હોય.

એ જ વિનયની વાત કરતાં ઈસુ ખિસ્તે પોતાના શિષ્યોને કહ્યું, ‘ મેં પ્રભુ અને ગુરુ થઈને

તમારું પાદપ્રક્ષાલન કર્યું, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમને દૃષ્ટાંત આચ્છું કે જેવું મેં તમારી સાથે કર્યું, તેવું તમે બીજાની સાથે કરો.’ ઈસુ ખિસ્તના ‘ન્યૂ ટેસ્ટામેન્ટ’ ના આ વચનો વિનયના વ્યાવહારિક પાસાને પ્રગાટ કરે છે. એમણે ખિસ્તી ધર્મના ધર્મગ્રંથ ‘ન્યૂ ટેસ્ટામેન્ટ’માં વિનયની વાત કરી છે. એ કહે છે કે, ‘સહુનો આદર કરો, ભાઈઓ સાથે પ્રેમ રાખો, પરમેશ્વરનો ડર રાખો અને રાજાનું સંભાન કરો.’ અહીં વિનય વ્યવહારના એક અંશ રૂપે પ્રગાટ થાય છે અને વ્યક્તિએ અન્ય પ્રત્યે કેવો આદરભાવ સેવવો જોઈએ તેની વાત કરી છે. એ દ્રષ્ટિએ જોઈએ તો વિનય એ માત્ર સર્કર્તનના અર્થમાં સીમિત છે.

ઈસ્લામ ધર્મનો અર્થ જ શાંતિ અને સલામતી થાય છે અને ઈસ્લામીનો અર્થ થાય છે કે અલ્લાહના હુકમ, ઈચ્છા, મરજી અને ઈશ્વરીય આદેશો, નિર્દેશો સામે સંપૂર્ણ આત્મ-સમર્પણ કરીને આ જીવનમાં નિર્દંતર શાંતિ અને સલામતી પ્રાપ્ત કરવી.

હજરત મુહમ્મદ સલ્લ માનવ સમાજને સમજાવતાં કહે છે કે એકબીજા પ્રત્યે વિનય અને પ્રેમભાવ જ અલ્લાહની બંદગી છે. અલ્લાહના આદેશોનું પાલન એ તેમના માટેનો વિનય દર્શાવે છે.

વિશ્વમાં ચીનના કન્ફ્યુશિયસ ધર્મે વ્યવહારનું શિક્ષણ આચ્છું છે. એમણે પ્રજાના આચરણ પર ભાર મૂક્યો. તેઓ માનતા હતા કે કલ્યાણની ભાવનાને મહત્વ મળવું જોઈએ. માનવસ્વભાવના સ્વાભાવિક સંદર્ભુણો પર વિશ્વાસ રાખવો જોઈએ અને પ્રજા પ્રત્યે શાસકો એમનું આચરણ આદર્શિક બનાવે તો રાજ્ય સ્વર્ગ બની શકે છે. કન્ફ્યુશિયસે સ્થાપેલા વિદ્યાલયમાં ત્રણ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. એમના અવસાન પછી એમના પાંચસો શિષ્યોએ ત્રણ વર્ષ સુધી એમની સમાદિ પર શોક પ્રગટ કર્યો હતો. કન્ફ્યુશિયસ ધર્મનો મુખ્ય ઉપદેશ એ છે કે માણસે


સહુ કોઈ પ્રત્યે પ્રેમ અને બંધુત્વની ભાવના રાખવી જોઈએ અને બીજા લોકોનો જે વ્યવહાર તમને પસંદ ન પડે તેવો વ્યવહાર બીજાઓ પ્રત્યે કરવો નહીં. પ્રેમ, ન્યાય, નમતા, વિવેક અને સત્યાધી એ પાંચ ગુણોનું હુંમેશાં દ્યાન રાખો એવો કન્ફ્યુશિયસનો ઉપદેશ હતો. એણે આ સંદર્ભમાં વિવેકની વાત કરતાં કહ્યું, ‘વૃદ્ધો તથા અનુભવી લોકોને તુચ્છ ન સમજો અને અસહાય અને વચ્ચમાં નાના હોય એમનો અનાદર ન કરો.’ વ્યાવહારિક વિનયની પરાકાણ જોવી હોય તો તમને એ ‘તાઓ’ ધર્મમાં જોવા મળશે. આ ધર્મના ‘દાઓ દિર કિંગ’ ગ્રંથમાં કહ્યું છે કે વિનિતતા એ ઉત્સ્વતાનો પાયો છે.

શિષ્ય: ‘પ્રલુ આપે કહ્યું કે વિનય અને વિનયમતા બહુ જરૂરી છે, પણ મને તો તે ફક્ત દુર્બળતા લાગે છે.’

ગુરુ: ‘હે પુત્ર, આ બધા જ ધર્મ ગુરુઓએ સંપૂર્ણ જનસમાજને વિનયના પાઠો અલગ અલગ રીતે શીખવ્યા જ છે. જે પોતે વિનયી બન્યા છે અને જગતને પણ વિનયના માર્ગ પર ચાલવાનો નિર્દેશ કરે છે. તું વિનયને નિર્બળતા માને છે તો પરમ પૂજય દાદાશ્રીએ પણ મહાત્માઓ અને મુમુક્ષુઓને જણાવ્યું છે કે “જેના વાણી, વર્તન ને વિનય મનોહર થાય તે લોકપૂજય થાય” એટલે પુત્ર, વિનય એ નિર્બળતા નથી.

પુત્ર, અન્ય પ્રત્યે વિનયપૂર્વક વર્તન રાખવું, તે આપણામાં સારા સંસ્કાર કેળવવા માટે જ છે. વિનય દુર્બળતા નથી. ‘હું મોટો માણસ છું’, આ ભાવ સાથે જ્યારે આપણે અન્ય લોકો પર કોઈ કરી, અહેંકારભર્યું વર્તન કરીએ ત્યારે આપણે એ મહાન પુસ્તો, ધર્મ ગુરુઓ અને ભગવાનના દુદયની વાત ચાદ કરવી જોઈએ. બધા જ ધર્મોમાં વિનયને મહત્વ આપવામાં આવ્યું છે. જે વિનયથી તારું અંતઃકરણ ખીલે છે એ જ વિનયની વાત’ ..

દાદાશ્રીના પુસ્તકની ઝલક



સેવાથી મેળવો મા-બાપનો રાજુપો

પ્રશ્નકર્તા : આ બધાંચના મા-બાપ ભેગા છે ને છોકરાઓ છે, તો આ સામાજિક જીવન એમણે કેવી રીતે જીવવું? મા-બાપે કેવી રીતે જીવવાનું, છોકરાએ કેવી રીતે જીવવાનું, આ એક મોટો કોચડો થઈ ગયો છે, તો એવો કંઈ રસ્તો નીકળવો જોઈએ કે એમને સમજાય?

દાદાશ્રી : પરસ્પર બધાને સુખ આપવાનો પ્રયત્ન કરે ને દુઃખ તો આપવું જ નહીં. સુખ જ આપવાનો પ્રયત્ન કરે.

પ્રશ્નકર્તા : સુખની વ્યાખ્યા ? સુખ કેવી રીતે આપવું?

દાદાશ્રી : મા-બાપને ગમે એ રીતે પોતે વર્તે. પોતે એમના આધીન જ રહેવું પડે. આ જ્ઞાન હોય ને, તો આત્મા છૂટો પડતો જાય એનો. છોકરાઓ બાપના આધીન વત્યા કરે, બાપના કણ્ણા પ્રમાણે. ન ગમે તોચ બાપના આધીન વત્યા કરે. પછી વિચાર કરે તો એને શાંતિ વળે, સુખ થાય મહીં, જો અવળો ન ચાલેતો. એ સુખ ક્યાંથી આવ્યું? ત્યારે કહે, આ પરાધીન હતું, તે દુઃખ જ હતું. સ્વાધીનપણાનું પછી સુખ ઉત્પન્ન થાય મહીં.

પ્રશ્નકર્તા : એ સ્વાધીનપણાનું સુખ કેવી રીતે ઉત્પન્ન થાય?

દાદાશ્રી : બાપના કણ્ણા પ્રમાણે ચાલે. પોતાને લાગે કે આ પરવશતા છે, પણ પછી સુખ લાગે એમાં.

પ્રશ્નકર્તા : એટલે મા-બાપના કહ્યા પ્રમાણે ચાલવું જોઈએ , એ નક્કી વાત થઈ.

દાદાશ્રી : ચાલવું જ જોઈએ ને ! સંસાર એનું નામ જ કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે મા-બાપનો રાજુપો મેળવવો જોઈએ ?

દાદાશ્રી : ત્યાં મા-બાપનો રાજુપો મેળવવો જોઈએ , એ માટે બધુંચ કરવું પડે.

પ્રશ્નકર્તા : સંસારમાં પહેલી ફરજ તો આ જ કહેવાયને ? મા-બાપને મન-વરચન-કાચાથી કિંચિત માશ દુઃખ ન થાય, કોઈપણ રીતે , એ પહેલી વાત.

દાદાશ્રી : મા-બાપ એકલાની નહીં. કાકા, મામા, કૂવા બદાની, દરેકની. અને છોકરાં-વહુની જોડે 'કેવી રીતે ફરજ રાખવી' એ બાપે સમજવું જોઈએ. બદા જોડે ફરજ બજાવવાની છે.

વિનય-વિવેક ન તોડાય કચારેય

પ્રશ્નકર્તા : આ બધું સમજાય છે પણ છતાં મા-બાપ સાથે જે વિનય-વિવેક જોઈએ ને , તે નથી જરાય.

દાદાશ્રી : ના , એ ન હોવું જોઈએ એ ખોટું કહેવાય. એ સો ટકા રોંગ છે , ચાલે નહીં. વિનયી વર્તન તિંચું હોવું જોઈએ. મા-બાપનો ઉપકાર કેમ ભૂલાય ? ઉપકાર ભૂલાય નહીં.

પ્રશ્નકર્તા : ઘણી વખત એ તો એવા શાણ બોલે છે ને , તેમને બહુ આધાત લાગે છે. એટલે આમ આખો દિવસ મને પછી ગભરામણ થાય ને એવું બધું થયા કરે.

દાદાશ્રી : આ નોંધ રાખતો નથી, મધર જે બોલે છે તે ડેકર્ડ બોલે છે તે ! જ્ઞાનપૂર્વક નોંધ-બોંધ કરવી જોઈએ. એમનો વિનય ન રાખું એવું અહીં ચાલે નહીં. મારી નાખે તો મરી જવું જોઈએ , પણ તે મા-બાપનો વિનય-વિવેક ન તોડાય.

પ્રશ્નકર્તા : હું એકસેપ્ટ (સ્વીકાર) કરું છું, દીકરા તરીકે મારા વિનય-વિવેક નથી બરાબર. પણ એવા સંયોગો આવી જાય છે કે બોલાઈ જવાય છે , મારી ઈરછા નથી હોતી પણ બોલાઈ જવાય છે. એનું પ્રતિક્રિમણ પણ કરું છું પણ બોલાઈ જવાય છે કોઈ વખત.

દાદાશ્રી : એ તો માફી માંગી લેવી તરત. બોલાઈ જવાય, પણ આપણું 'જ્ઞાન' જે છે તે હાજર થઈ જાય. ક્યાંક ભૂલ થઈ કે તરત માફી માંગી લેવી જોઈએ કે આ બોલાઈ ગયું એ ભૂલ થઈ. મમ્મીને કહેવું કે ફરી આવી ભૂલ નહીં કરું. આ તો મને ખરાબ લાગે. અમારી કેળવણી આવી હશે ? અમને એવું થાય. બહારનાને પ્રાસ નથી આપવાનું ત્યારે આ તો ઘરના બદા... .

પ્રશ્નકર્તા : દાદાના જે આજ્ઞાંકિત હોય, એના ઘરમાં તો એકદમ વાતાવરણ પ્રકુલ્પિત જ હોવું જોઈએ. પણ આ તો કહે, એના મગજ ઉપર કાચામ બોજો જ રહ્યા કરે છે.

દાદાશ્રી : એ તો અત્યારે વિનય ધર્મની વાત કરે છે. વિનય ધર્મ તારે કેવો રાખવાનો ? તું શું કહું છું ?

પ્રશ્નકર્તા : બરાબર છે , વિનય હોવો જ જોઈએ.

દાદાશ્રી : બહાર પણ હોવો જોઈએ , તો ઘરમાં કેવો હોવો જોઈએ ?

પ્રશ્નકર્તા : આદર્શ હોવો જોઈએ.

દાદાશ્રી : એટલે હવે તારાથી શાણ્ણો નીકળી જાય છે એ વાત ઉપરથી કહીએ છીએ. પણ એની પાછળ જાગૃતિ , આપણું જ્ઞાન હોય એટલે તરત માફી માંગી લઈએ. એટલે એમને ઘા ન લાગે.

ઉંઘી તપેલી

શરાય મુનિ વિહાર કરતાં-કરતાં ધનજ નગરી કે જે વિદ્યા વિહોણાઓની નગરી તરીકે પ્રસિદ્ધ છે ત્યાં પહોંચે છે. તેમને આ સાંભળીને આશ્રય થાય છે કે આ નગરીની કોઈ પણ વ્યક્તિએ કોઈની પણ પાસેથી વિદ્યા નથી મેળવી શકતી.

મુનિશ્રી રટ્ઝના શેઠના ઘરે બિક્ષા લેવા પહોંચે છે. તે જ સમયે શેઠનો પુત્ર વિદ્યાશ્રમથી પાછો ફરતો હોય છે અને તે શેઠને કહે છે, “ગુરુજી કરતાં તો મને આવડે છે. તેમને તો ચાસતા પણ નથી આવડતું.” પોતાના અપંગ ગુરુની અવગાણના કરતાં રટ્ઝના પુત્ર અવકાશ આવા શાંદો ઉચ્ચારાતા ઘરમાં પ્રવેશો છે. મુનિશ્રીને થાય છે, જે ગુરુનો વિનય ન કરી શકે તેના ઘરેથી હું બિક્ષા ન લઈ. આમ વિચારી તેઓ મચ્યુ મોચીના દ્વાર પર જાય છે મચ્યુના પિતા તેને દુકાનની સામગ્રી બાબતે માર્ગદર્શન આપતા હોય છે. પરંતુ, મચ્યુ તેના પિતાને કહે છે, “જો તમારા જ કહ્યા પ્રમાણે મારે કરવાનું હોય તો તમે જ ચલાવો દુકાન.” મુનિ ત્યાંથી પણ ચાલ્યા. આગળ વધતાં નાગર નર્તકીનું ભવન આવ્યું. મુનિશ્રીને થયું નર્તકી તેના ગુરુના વિનયથી જ તો આટલું સરસ નૃત્ય શીખી છશે. તે ચોક્કસ વિનયથી છશે, એવું વિચારી મુનિશ્રી તેના દ્વાર પર બિક્ષા માગે છે. નર્તકી તેની સહેલી સાથે વાતો કરતી મુનિશ્રીને બિક્ષા આપવા આવે છે એ જ સમયે તેની વરિષ્ઠ નર્તકી તારા તેના ભવન પર પદ્ધારે છે અને તે મુનિશ્રીને પ્રણામ કરી નાગરને જણાવે છે કે તે આગળના નૃત્યની તૈયારી માટે તેની સાથે રહીને તેને મદદ કરશે. આમ કહી તે ચાલી જાય છે. પરંતુ, નાગર નર્તકી તારા માટે અપશાંદો બોલે છે.

“ગુરુજી કરતાં
તો મને
આવડે છે.
તેમને તો
ચાસતા પણ
નથી
આવડતું.”

મુનિશ્રી લીદેલી ભિક્ષા પાત્રમાંથી ટોળી દે છે. હવે, જાણે શરણ્ય મુનિ ભિક્ષાને બદલે વિનય શોધતા હોય તેમ ધનજ નગરીના દરેક ધરમાં જઈ ઊભા રહે છે અને દરેક ધરમાં અવિનયનો અંશ મળતા પાછા ફરે છે. કોઈ ભાઇનો, બહેનનો, માતાનો, પિતાનો, ગુરુનો, વડીલોનો, તો કોઈ પડોશીઓનો, સંતોનો તો કોઈ મિત્રોનો અવિનય કરતા જ જણાય છે.

મુનિશ્રી આખો દિવસ ફરીને અંતે એક જાડ નીચે દ્વારા માટે બેઠા. સવાર પડતાંની સાથે જ મુનિશ્રીએ ગામમાં ટંદેરો પિટાવ્યો કે જે કોઈ પણ મારી તપેલીમાં કંઈ પણ ભરી આપશે દી, છાશ, દૂધ, જમવાનું તેને હું વિદ્યા આપીશ. આ નગરી વિદ્યાવિહોણાના કલંકમાંથી મુક્ત થશે. બધાએ વિચાર્યું કે કલંક તો જશે પણ અમારી નગરી બીજાથી પછાત રહી ગઈ છે તે પણ આગળ આવશે. ચાલો, મુનિનું એક જ પાત્ર તો ભરવાનું છે.

શરણ્ય મુનિ તપેલી ઊંધી કરી બેસી ગયા. જેટલા પણ આવે તે બધા તપેલીમાં નાખવા જાય એટલે મુનિ તપેલી ઊંધી કરી નાખે. જો થોડું પણ તપેલીમાં પડે તો મુનિ તપેલી ઊંધી કરી દે. એટલે ટોળાઈ જાય. મુનિનું આવું વર્તન જોઈ બધાને થયું મુનિનું માનસ બગડયું છે. તેઓ વિદ્યા આપવાના બહાને બધાનું નુકસાન કરે છે. મુનિએ પાછું કહ્યું,

“તમારામાં છિંમત હોય તો મારી તપેલી ભરીને બતાવો.” અમુકના અહંકાર ઘવાયા અને તેઓએ નક્કી કર્યું કે મુનિની તપેલી ભરીને જ રહીશ. પણ, કોઈ કંઈ પણ ન કરી શક્યું.

શેઠ રલનશ્રીના પુત્ર અવકાશે આ જોયું કે આ મુનિ પાત્ર ઊંધું કરીને કહે છે આને ભરી દો. એમ થોડું ભરાય? લાવ, હું એમને સમજ પાડું કે પાત્ર સીધું કરો. અવકાશે મુનિને કહ્યું, “મુનિશ્રી, આપનું પાત્ર સીધું કરો તો હું તેમાં આ મીઠાઈ નાખી શકું.” મુનિએ પાત્ર ઊંધું જ રાખ્યું. અવકાશે તપેલી સીધી કરી અને મીઠાઈ રાખવા જાય છે તો મુનિએ પાત્ર ઊંધું વાળી દીધું. મુનિના આવા અધમ વર્તનથી ત્રાસીને અવકાશે ઊંચા અવાજે કહ્યું, “મુનિ, પાત્ર કરો સીધું, તપેલી ઊંધી છે.”

આ સાંભળી મુનિએ કહ્યું, “તમે બધા પણ તમારી તપેલી સીધી કરો. ઊંધી છે...” બધા સ્તરથી થઈ ગયા “અમારી તપેલી ઊંધી???”

મુનિશ્રીએ ઝોડ પાડતાં કહ્યું જેમ તપેલી ઊંધી હતી તો તેમાં કંઈ પણ ન સમાય એવી જ રીતે તમારે જેની પાસેથી શીખવાનું, સમજવાનું કે કંઈ પણ મેળવવાનું છે તેની પાસે તપેલી સીધી રાખવી પડશે. વિનય એ સીધી તપેલી છે અને ઊંધી કરશો, અવિનય કરશો તો બધું જ તપેલીમાંથી ટોળાઈ જશે.

માતા-પિતા, ભાઈ-ખણેન, મિત્રો, ગુરુ કે વડીલો કે કોઈ પણ પાસેથી કાંઈ પણ શીખવાનો એક જ રસ્તો છે. “વિનય.” એમની પાસેનું જ્ઞાન તમારામાં ખેવા માટેનો. જેટસી તપેલી સીધી છશે એટલું મણશે. જેની તપેલી આડી કે ઊંધી થશે તેનું તેટલું ટોળાઈ જશે.

વિનયના ફાયદા

વિનય શા માટે કરવો જોઈએ? એનાથી આપણાને શું ફાયદો થાય? અવિનય કરવાથી શું થઈ જવાનું? જેવા અનેક સવાલો આપણા મનમાં ઉદ્ભબે એ સ્વાભાવિક છે... આ સવાલોના જવાબ જાળવા ચાલો, આપણે આ લેખ વાંચીએ.

જે વ્યક્તિનો વિનય કરીએ
એ વ્યક્તિના આશીર્વદ આપણાને મળે.



વિનય કરવાથી જીવન આનંદમય થઈ જાય.



વિનય કરવાથી આપણું કામ સરળ થઈ જાય
અને આપણાને સંમાન મળે.



વિનય કરવાથી સિન્સિયારીટી વધે.



જેમનો વિનય કરીએ એમનો
રાજુપો આપણાને મળે.



વિનય કરવાથી કામ કરવામાં થાક ન
લાગે અને પરિણામ પણ સારું આવે.



વિનયવાળી વ્યક્તિ બધાને ગમતી થઈ જાય
અને એને બધા સાથે અભેદતા લાગે.



જેમનો વિનય કરીએ એ વ્યક્તિ પણ આપણાને
મદદ કરે જેથી આપણી અંદર પોઝિટિવિટી વધે.

અવિનયના નુકસાન

ટીચરનો અવિનય કરવાથી આપણું
રિઝલ્ટ ખરાબ થાય.



અવિનય કરવાથી બધાની સામે આપણી છાપ બગાડે.



જેમનો અવિનય કરીએ એમનો
રાજુપો આપણાને ન મળે.



જે વ્યક્તિનો વિનય આપણે નથી કરતા
તે વ્યક્તિ પણ આપણો વિનય નથી કરતી.



જે વ્યક્તિનો આપણે વિનય નથી કરતા એ
વ્યક્તિ અને આપણી વર્ષે મતાભેદ પડે.



બીજાનો અવિનય કરવાથી
આપણા કામમાં પણ અંતરાય આવે.



Q & A

પ્રશ્નકર્તા : વિનય કેવી રીતે તૂટે છે?

આપણું : આપણા માન, આપણા અહુંકાર એટલા મોટા થઈ ગયા છે ને કે દાદા શું કહે છે, કે માનથી વિનય તૂટે છે અને અહુંકારથી પરમ વિનય ચૂકાય છે. એટલે ખરેખર તો દરેકમાં કંઈક પોજિટિવ જોઈને એની કદર કરીએ તો તેનામાં જે ગુણ હોય એ આપણામાં પ્રગટ થાય. દરેકમાં શું પોજિટિવ છે એ તરફ દ્રષ્ટિ આપણે રાખવી છે. એટલે પોજિટિવ જોવું છે. પોજિટિવ જોઈને અહુંકાર લઘુ થાય અને અહુંકાર લઘુ થાય તો એની મેળે પેલું માન તૂટે તો એની મેળે વિનયી થવાય. અને તેમજ બીજા બધા જોડે એડજસ્ટ થાઓ ને, જો આજે તારા મમ્મી સાથે એડજસ્ટમેન્ટ લેવાના હોય તો તારે તારો અહુંકાર નીચો કરવો પડે તો જ તું તારા મમ્મી સાથે એડજસ્ટ થાય. તો દલીલ ન થાય અને તું મમ્મીના વિનયમાં રહે! તેઓ આપણા કરતાં ઉમરમાં અને દરેક બાબતમાં મોટા છે, તો આપણે એમની વાત કાને ઘરવી જોઈએ, અને આજે તું વિચારે કે મમ્મી ક્યાં વધારે ભણોલી, કેટલું ધૂંગલીશ ફાવે, કમચુટર પણ ન ફાવે અનુંજરા કમાન ચગી જાય ને એવા જાતજાતના અહુંકારમાં ફરતા હોઈએ તો એ માનથી વિનય તૂટે છે. હું બહુ હોંશિયાર છું અનુંથાય... પણ પછી એનાથી મમ્મીનો વિનય તૂટવાનો. અને મમ્મીના દોષ જોઈએ, અને બીજાના દોષ જોઈએ ત્યાં વિનય તૂટે છે અને કોઈના દોષ ન દેખાય તો વિનયમાં રહેવાય. એડજસ્ટ થવું હોય તો આપણે આપણો અહુંકાર નીચો કરવો પડે તો જ એડજસ્ટમેન્ટ લઈ શકીએ. અને બીજા સાથે એડજસ્ટ એવરીવેર થવામાં પણ માન તૂટે છે. એટલે મારે બધા સાથે એડજસ્ટ થવું છે પણ લોકોને મારી સાથે એડજસ્ટ નથી કરવા અનું વલણ રાખવું જોઈએ.

અવિનય

ઈ રણ | - અ નિ રણ | અે
આપણાથી ધારી વાર બીજાનો
અવિનય થઈ જતો હોય છે. જેની
આપણાને અમુક વાર જાણ પણ
નથી હોતી. તો ચાલો ભેઈએ કે
આપણે ક્યાં ક્યાં વિનય ચૂકી
જતા હોઈએ છીએ.

દીચસ

જ્યારે સ્કૂલ કે કોલેજમાં
ટીચર આપણી કોઈપણ
પરીસ્થિતિ સમજ્યા વગર આપણું
અપમાન કરે કે આપણાને
પનીશમેન્ટ આપે ત્યારે આપણાથી
અવિનય થઈ જતો હોય છે.

ક્યાં

ક્યાં

થાય

છે?

મમ્મી

જ્યારે મમ્મી સારી સલાહ આપે
ત્યારે આપણે મોબાઇલ અને આપણા
કામમાં મશગૂલ રહીએ, મમ્મીને ઇન્ફારેડ
કરીએ, એની વાત ન સાંભળીએ,
આપણે જે કરવું હોય એ જ કરીએ એ
રીતે આપણાથી મમ્મીનો અવિનય થઈ
લાય છે. અને આપણે આપણું ધાર્યું કામ
કરાવવા માટે મમ્મી-પઢ્યાની સામે
બોલીને અવિનય કરતા હોઈએ છીએ.

જ્યારે પેરેન્ટ્સ મીટિંગમાં મમ્મી
આપણી સાથે આવે અને જ્યારે મેડમ
ઇંગ્લીશમાં વાત કરે અને મમ્મીને કંઈ
સમજાણ ન પડે ત્યારે આપણે એને જેમ
તેમ બોલીને તેનો અવિનય કરતાં
હોઈએ છીએ.

પાડોશીઓ

જ્યારે આપણે કંઈ ખોટું કામ કર્યું ન હોય તો પણ આપણા પાડોશી આપણા ધરે આવીને આપણા
મમ્મીને કહે તમારી છોકરીએ આવું કર્યું અને તેવું કર્યું, પણ હકીકતમાં આપણે તેવું કર્યું જ ન હોય ત્યારે
આપણાથી ઊંચા અવાજે બોલીને પાડોશીનો અવિનય થઈ જતો હોય છે.

ખર્ચિનયથી વિનય તરફ ➢

ચિદ્ધિ દરેક સમર કેમ્પ પછી, ઘરે એક નવા નિશ્ચય અને નવી સમજણા સાથે આવે. અને તે સમજણાને પોતાના જીવનમાં ઉતારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે.

આ વખતે સમર કેમ્પમાંથી આવી, બીજા દિવસે સવારે ચિદ્ધિ મમ્મીને પગે લાગી. આ જોઈ ધરમાં બધાની આંખો પહોળી થઈ ગઈ. પણ ઓફીસે જવા નીકળ્યા તો તેમને પણ પગે લાગી. હવે તો મોટી બહેનથી રહેવાયું નહિ. તે મોટે-મોટેથી હસવા લાગી અને ચિદ્ધિના નવા વર્તન માટે મજાક કરવા લાગી. ચિદ્ધિએ પણ દીદીની મજાકને મજાકમાં લઇને કહી દીધું, “હવેથી હું દરરોજ મમ્મી-પણાને પગે લાગીશ. તારે જેટલું હસવું હોય એટલું હસ. આમ પણ મોટા એ કામના ખોટા. એ કહેવત તારા માટે જ છે.” બંને બહેનોએ એક-બીજા સાથે મસ્તી મજાક કરી અને આટલા દિવસ સમર કેમ્પમાં શું કર્યું અને ઘરે શું ધમાલો થઈ એની વાતો કરી. પરંતુ દીદીને તો ચિદ્ધિમાં આવેલા પરિવર્તન માટે ખૂબ હસવું આવતું હતું.

તેણે ચિદ્ધિને પૂછ્યું કે, એવું તો શું થયું સમર કેમ્પમાં કે અચાનક આવો ધરખમ ફેરફાર થઈ ગયો? ચિદ્ધિએ તેના આ સવાલને જાણે ગણકાર્યો જ ન હોય તેમ જવા દીધો.

હવેથી રોજ દિવસ ઊગે અને પણાનો ઓફીસે જવાનો સમય થાય, એ જ સમયે દીદી નાસ્તો કરતાં- કરતાં ચિદ્ધિને ભૂમ પાડે. “એ... ચિદ્ધિ જો પણ ઓફીસે જાય છે. તારે પગે નથી લાગવાનું?” ચિદ્ધિ દીદીનો અવાજ સાંભળી દોડતી આવી પણાને પગે લાગે અને દીદીને ‘થેંક યુ’ કહે.

હવે, તો આ હિનયર્યા બની ગઈ. જેમ-જેમ

દિવસો વીતવા લાગ્યા તેમ-તેમ દીદીએ આ વાત માટે ચિદ્ધિની મજાક ઉડાવવાનું ઓછું કરી દીધું.

એક દિવસ મામા-મામી ઘરે રોકાવા માટે આવે છે. તેઓ ચિદ્ધિને મમ્મી-પણાને પગે લાગતા જોઈને ખૂબ ખુશ થયા. તેમણે ચિદ્ધિને આશીર્વદ આપતા કહ્યું, “ખૂબ સરસ દીકરા, આવી સરસ સમજણ કેળવીને ખૂબ આગળ વધ.” આ જોઈને દીદીને વિચાર આવ્યો કે, “આ નાની છે છતાં, રોજ મમ્મી-પણાને પગે લાગે છે. હા, થોડી તોફાની અને જિદી છે. અને પહેલાં કયારેક મમ્મી-પણાની સામે બોલતી હતી પણ હવે એકદમ સરસ વર્તન કરે છે. કોઈનો અવિનય કરતી નથી. જો એ નાની થઈને રોજ મમ્મી-પણાને પગે લાગે તો હું તો એનાથી મોટી છું. ભલે કદાચ હું એના જેવું ન કરી શકું, પણ શરૂઆત તો કરું. દરરોજ નહીં તો જ્યારે ચાદ આવે ત્યારે-ત્યારે હું પણ મમ્મી-પણાને પગે લાગવાનું શરૂ કરું.”

આમ, વિચારી દીદી પણ બીજા દિવસે સવારે ઊઠી મમ્મી-પણાને પગે લાગી. આ જોઈ બાજુવાળા કિરણ માસી ઢોડી આવ્યા. “શું વાત છે અરુણાબેન, તમારા ધરમાં તો એક પછી એક બધા ડાહ્યા થતા જાય છે ને, શું બનાવીને જમાડો છો કે આવું સરસ પરિવર્તન આવવા લાગ્યું? જરા મને પણ એ રેસિપી આપજો.”

બધા આ વાત પર છસી પડ્યા.....

પણ, પણ સાચે વિચારમાં હતા કે, આવું પરિવર્તન કેવી રીતે આવ્યું? ચિદ્ધિએ સમર કેમ્પમાં શીખ્યું હશે કદાચ પણ, એની દીદી ??

ચાલો, જાણીએ દાઢાશ્રી આના વિષે શું કહે છે?

જ્ઞાનીની વૈજ્ઞાનિક દ્રષ્ટિઓ



વિનયી લોકોને જોવાથી આવે વિનય.

વિનયથી તો માણસ શોભે છે. અત્યારે ઉદ્ઘતાઇ કરવા જાય કે 'હું કલેક્ટર છું ને આમ તેમ...' તો લોકો એને 'ગાંડો છે, ચક્કર છે' કહેશે. અહીં સંસારમાંચ ઉદ્ઘતાઇ કરવા જેવી નથી. ત્યારે જ્ઞાની પુરુષ એટલે શું કે આખા બછાંડના ઉપરો કહેવાય. તે ઉદ્ઘતાઇ કરે નહીં. એ તો બાળક જેવો હોય. અહીં ટીપી થોડોક મોટો થયો, કલેક્ટર કે ઓફિસર થયો તો કેટલીય છાતી કાઢીને ફરે! એને ઉદ્ઘતાઇ કહેવાય.

વિનય વગાર તો માણસ, માણસ જ ના કહેવાય. પરમ વિનય તો જુદી વસ્તુ પણ વિનય જોઈએ. આપણા દરેક પુસ્તકમાં આવું લખેલું હોય, તે કિંમત સમજાય તોય બહુ થઈ ગયું.

પ્રશ્નકર્તા: વિનય લાવવા માટે પ્રયત્ન તો કરવો પડે ને, ખાણવું પડે ને?

દાદાશ્રી: પ્રયત્ન કરવાના ના હોય, જોવાનું જ હોય. અહીં આવીને તમારે બેસી રહેવાનું અને વિનયી લોકોનું વર્તન જોયા કરવાનું. જોવાથી વિનય આવડે. આજુબાજુ જોઈએ, કોઈ બોલતું નથી એટલે આપણાને વિનય આવે તો આપણે ન બોલવું જોઈએ. એટલે જોવાથી વિનય આવે. જોવાથી, શીખવાનું ન હોય, પ્રયત્નોય ન કરવો પડે. (વિનયવાળાને જોવાથી) ખાલી જરા દાખ્લેશન (છાપ) પડે. આ વિનય, પરમ વિનય બદ્દી દાખ્લેશન છે. એટલે કાચદો નથી આપણે ત્યાં, નો લોંલો.

જ્ઞાની પુલ્લથનો પરમ વિનય

'પરમ વિનય' શબ્દ સાંભળતાં જ નીરુમા યાદ આવે. ૨૦૦૪માં રાજકોટમાં જન્મજયંતિ હતી અને ટીવીમાં નીરુમાનો સત્સંગ આવે એટલે બધા લોકો નીરુમાને જ ઓળખે, દાદાને તો કોઈ ઓળખતું ન હોય એટલે જન્મજયંતિ દાદાની હોય દાદાનું પોસ્ટર સગાડવાનું હોય તો પછી અમને બધાને થાય કે સોકો બધા નીરુમાને જુબે છે ટીવીમાં અને ફોટો આપણે દાદાના મૂકીએ છીએ. તો દાદાના ફોટોમાં નીરુમાનો ફોટો મૂકીએ તો લોકો યોડા જલદી કનેક્ટ થશે.



એટલે જલદી સર્કલમાં જોડાશે કે ટીવીમાં સત્સંગનો લાભ લેશે. એટલે અમે થોડાક પોસ્ટર લગાવી નાખ્યા હતા. પછી હું હતો, ડિમ્પલબાઈ હતા, સંજ્યબાઈ હતા, અમે બધાએ નીરુમાનું એક કલાક રીતસરનું માથું ખાદું કે નીરુમા તમારો ફોટો મૂકવા દો. અને લોકો તમને ઓળખે છે. અમે આ બદું લોકો વધારે પામે અના માટે કરીએ છીએ.

આમ એટલું બદું કહ્યું પણ નીરુમા ના જ પાડે અને બહુ જ માથું ખાદું કલાક-બે કલાક. તો પછી નીરુમા કહે, “સારું ફોટો મૂકવાની છૂટ છે પણ એક જ ફોટો મૂકવાનો અને ફોટો કર્યો એ હું ડીસાઇડ કરીશ. પછી એમણે દાદા નીરુમાને આશીર્વાદ આપતા હતા એ ફોટો તમારે મૂકવો હોય તો મૂકો એમ કહ્યું. અમે દાદાના આશ્રિત છીએ. દાદા જ મુખ્ય છે જેને સ્વયં પ્રગત થયું હોય ને એ જ્ઞાની અજોડ જ હોય અને અમે અના આશ્રિત કહેવાઈએ.” એટલે એટલો બધો આપણને અહોભાવ થાય. આ તો દાદા નથી અને દાદા જવાબદારી સંંપીને ગયા છે તો એમની આજ્ઞામાં રહીને જ પૂરી કરીએ, પણ દિલમાં તો દાદા જ છે. તેઓ એક સેકન્ડ માટે પણ પરમ વિનયમાંથી વિનયમાં પણ ગયા નથી એટલો બધો જબરદસ્ત પરમ વિનય.

પછી ૨૦૦૫માં ભાવનગરમાં જન્મજયંતિ હતી એટલે અમે લોકોએ નીરુમાનો ફોટો મૂક્યો. અને તે નીરુમાએ જોયો અને પછી એવા ખખડાવ્યા છે કે, કોને પૂછીને મૂક્યા? અમે કહ્યું નીરુમા આ તમે તો કહેલું. નીરુમા કહે મને તો ચાદ પણ નથી.

એમના દિલની ઈરણા જ ન હતી એમનો ફોટો મૂકવાની. નીરુમા કહે છે કે મારો ફોટો ન હોય, દાદાનો જ હોય અને પછી એ છેલ્લી જન્મજયંતિ હતી. ત્યાર પછી નીરુમાનો દેહવિલય થયો પછી તેમણે કહેલો આ એક જ ફોટો મૂકાય છે. નીરુમા કોઈના ધરમાંચ એમના ફોટા ન મૂકવા દે, દાદાના ફોટા મૂકો. પૂજ્યશ્રીને પણ આજની તારીખે કોઈએ ફોટા મૂક્યા હોય એ ગમે નહીં. એ કહે કે જે છે એ દાદા જ છે. અને એ ૩૫૬° એથી ૩૫૮° એ પહોંચેલા એટલે એમનું નિદિષ્યાસન કરશો તો વધારે તમારું કામ થશે અમને કોઈને પૂજાવું જ નથી, કે પોતાનું માન કે નામના કે કીર્તિની પડી નથી અને જોઈતું ચ નથી. નીરુમા આ બદું પૂર્વનું લઈને આવ્યા હોય એવું અમને સમજાય. અને દાદા મળ્યા ન હતા એ પહેલાં નીરુમાને એક વખત સપનામાં દાદા આવ્યા અને સપનામાં દાદા એમને આકાશમાં ખૂલ ઊંચે ઊંચે લઇ જતા હતા અને સપનામાં જ એમને વિચાર આવે છે કે હું ઉપરથી નીચે પડી જઈશ તો? એટલોય વિચાર એમને સપનામાં આવે છે અને સપનામાં માછલી થઇ જાય છે, એટલે દાદાને મળતા પહેલાં જ એમણે નક્કી કરેલું કે મને જે મહાપુરુષ મળે કે જે મને આગળ લઇ જતા હોય તો એમના માટે હું કોઈ દિવસ શંકા નહીં કરું. એ મળતાં પહેલાં ગાંઢ વાળેલી. આખી જિંદગી અને પછી એક વિકલ્પ નથી થયો કે એક દોષ પણ નથી થયો.



youth.dadabhagwan.org

We are today's Youth. We want to change the world. We want to be better people. We seek a deeper understanding of ourselves and the world around us. And so

this website is for us. There are things we all want to learn about, Spiritual guidance for our everyday challenges, topics relevant to our personal growth and much more. Together, let us embark on a journey to achieve our highest potential, and become instruments of love, wisdom and inspiration to those around us.

ધિનાચ કે અધિનાચ ?



માત્ર બગ્રીસ વર્ષના આચુષ્યમાં જગત વિજેતા બનનાર શાહેનશાહ સિંકદરે પ્રસિદ્ધ દાર્શનિક એરિસ્ટોટલ પાસે ગ્રીક સાહિત્ય, વિજ્ઞાન, હોમરનાં મહાકાવ્યો, વીરકથાઓ વગેરેનો અભ્યાસ કર્યો હતો.

એકવાર ગુરુ એરિસ્ટોટલ અને શિષ્ય સિંકદર ઘનઘોર જ્ઞાનમાંથી પસાર થતા હતા. રસ્તામાં એક નાળું આવ્યું, જેમાં પૂરને કારણે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હતો. નાળું ઊંડું હતું અને ગુરુ એરિસ્ટોટલ એ નાળામાં પ્રવેશ કરવા જતા હતા, પરંતુ સિંકદરે એમને અટકાવ્યા અને પછી તો ગુરુ-શિષ્ય વચ્ચે પહેલા કોણ નાળું પસાર કરે, એ વિશે મોટો વિવાદ જાગ્યો.

સિંકદર તો હઠ પકડીને બેઠો કે એ જ પહેલાં નાળું પસાર કરશે. બન્ને વચ્ચે થોડા વિવાદ પછી ગુરુ એરિસ્ટોટલને પોતાના શિષ્યની વાતનો સ્વીકાર કરવો પડયો. સિંકદરે પહેલાં નાળું પસાર કર્યું અને પછી એરિસ્ટોટલે. નાળું પસાર કરીને સામી બાજુએ પહોંચ્યા પછી ફરી બંને વચ્ચે ચર્ચા જાગી. મહાન ચિંતક એરિસ્ટોટલે કહ્યું, 'સિંકદર, હું તારો ગુરુ છું. મારે આગળ રહેવું જોઈએ, તે આવી હઠ શા માટે પકડી ? મારી આબરૂ કેમ ઓછી કરી ?'

સિંકદરે નમૃતાથી ગુરુને કહ્યું, 'ગુરુદેવ, આવું બોલશો નથી', આપની બેઇજજતી હું કરું ખરો

? કિંતુ નાળામાં પહેલાં ઉત્તરવું એ મારું પરમ કર્તવ્ય હતું.'

એરિસ્ટોટલે શિષ્યની વાત અધિવરચ્યેથી અટકાવીને પૂછ્યું, 'શા માટે ? એવું શું હતું ?'

સમાટ સિંકદરે ઉત્તર આપ્યો, 'ગુરુદેવ, એરિસ્ટોટલ હશે તો હજારો સિંકદર પેદા થશે, પણ સિંકદર બિચારો એકેય એરિસ્ટોટલ સજ્જ શકશે નથી.'

જગત વિજેતા સિંકદરમાં પોતાના ગુરુ પ્રત્યેનો કેવો અગાધ વિનય હતો એનો અહીં ખ્યાલ આવે છે.

વ્યાવહારિક દ્રષ્ટિએ વિનયને અનેક રૂપે બેઇજ શકાય. પોતાનાથી અધિક ગુણવાન વ્યક્તિ પ્રત્યે આદર આપવો તે વિનયનો એક પ્રકાર છે, તો વિનયનો બીજો પ્રકાર એ કે પૂજ્ય પ્રત્યે સંઈવ આદર રાખવો. જીવનમાં વિનય વ્યક્તિત્વને પ્રિય બનાવે છે. એવું કહી શકાય કે વ્યક્તિ વિનય દાખવીને બીજાનું હૃદય જુતી લે છે. અને એથી જ કહેવાયું છે કે 'નમે તે સૌને ગમે'.

માર્ગમારી

જવાબ છેલ્લા પાને મળશે...



+



+



રાગ

+



=

વિતરાગનો



=



+



=



+



=



=



=



+



=



+



=



=



+



=



=



=



=

=



=



+



=

$$\text{સુધી} + \star \text{maa} = \boxed{\quad} \times 2 = \boxed{\quad} \quad \boxed{\quad}$$

$$સ + રવામં = \boxed{\quad} \quad \boxed{\quad} \text{AWAY} = \boxed{\quad}$$

$$૬ = \boxed{\quad} \quad \boxed{\quad} + \text{Wahh..} = \boxed{\quad}$$

$$\text{પારડી} - D = \boxed{\quad} \quad \boxed{\quad} + \text{No!} = \boxed{\quad}$$

$$V + \text{☀️} = \boxed{\quad} \quad \boxed{\quad} = \boxed{\quad} \quad \boxed{\quad} = \boxed{\quad}$$

$$\& = \boxed{\quad} \quad \text{Last} = \boxed{\quad}$$

$$ખ + PLAY = \boxed{\quad} \quad V + X = \boxed{\quad}$$

$$\text{થ} + \text{Yo!} = \boxed{\quad} \quad A + ટલ = \boxed{\quad}$$

$$\text{થ} + ક્ષ = \boxed{\quad} \quad \text{THAI} = \boxed{\quad}$$

વર્ષ: ૬, અંક : ૮
સપ્તાહ અંક : ૬૮
ડિસેમ્બર ૨૦૧૮

Date of Publication: 22nd of Every Month
RNI No. GUJGUJ/2013/53113
Reg. No. G-GNR-310/2017-2019
Valid up to 31-12-2019
LPWP Licence No . CPMG/120/2017
Valid up to 31-12-2019
Posted at Adalaj Post Office
on 22th of every month

આ વિનય ધર્મની શરૂઆત
હિંદુસ્તાનમાં થાય છે.
હાથ જોડવાથી તે સાષ્ટાંગ પ્રણામ
સુધીમાં જે જે કરવામાં આવે છે,
તેવા પાર વગરના વિનય ધર્મ છે
અને છેવટે 'પરમ વિનય' થયો
એટલે મોક્ષ થાય.

Send your suggestions and feedback at: akramyouth@dadabhagwan.org

Printed and Published by Dimple Mehta on behalf of Mahavideh Foundation-Owner.

Printed at : Amba Offset, B-99, GIDC, Sector-25, Gandhinagar – 382025.

